



રેસ્ટોરેન્ટ અને અન્ય આતિથ્ય સત્કાર
જગ્યાએ COVID-19 અટકાયત માટે ના
ઉપાયો.

1. તમામ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રેસ્ટોરન્ટ બંધ રહેશે. ફક્ત કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
2. ૬૫ વર્ષ થી વધુ વયના વ્યક્તિઓ, કોમોરબીડીટીઝ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષ થી નીચેના બાળકોને ઘરે રહેવા સલાહ આપવામાં આવે છે. રેસ્ટોરન્ટ પણ તે અંગે જરૂરી સલાહ આપવાની રહેશે.
3. COVID-19 અંતર્ગત કેટલાક જરૂરી સૂચનો દરેક સ્ટાફ તેમજ પાલન કરાવાના રહેશે
 - બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર રાખવાનું રહેશે
 - ફરજિયાત માસ્ક/ ફેસ કવર નો ઉપયોગ કરવો.
 - ૪૦ થી ૬૦ સેકન્ડ સુધી હાથ ધોવા. આલ્કોહોલ બેઇઝ સેનેટાઈઝર નો ઉપયોગ કરવો.
 - ખાસી કે છીક ખાતી વખતે મોઢા ઉપર રૂમાલ કે ટીસ્યુ રાખવું તેમજ તરતજ તેને ડીઝપોઝ કરવું.
 - પોતાની આરોગ્ય ચકાસવું તેમજ માંદગી જણાય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરવો.
 - જાહેરમાં થુકવું નહિ.
 - આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી.
4. રેસ્ટોરન્ટએ નીચે મુજબનું આયોજન કરવાનું રહેશે.
 - ડાઈન-ઇન ને બદલે ટેક અવે (પાર્સલ) સુવિધાને મહત્વ આપવાનું રહેશે. ડીલીવરી બોયએ ગ્રાહકને સીધા પેકેટ આપવાને બદલે દરવાજા પર મુકવા હિતાવહ છે.
 - હોમ ડીલીવરી ના સ્ટાફ ને થર્મલ સ્કેનર થી સ્કેન કરવાના રહેશે
 - એન્ટ્રન્સ પર સેનેટાઈઝર, પલ્સ ઓક્સિમીટર અને થર્મલ સ્કેનર ફરજિયાત મુકવા અને હાઇજીન મેન્ટેન કરવું.
 - પલ્સ ઓક્સિમીટર વડે મુલાકાતીઓના ઓક્સિજન લેવલની નિયમિત ચકાસણી કરવી અને જો રીડીંગ 95% થી ઓછું આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરવો અથવા 104 પર જાણ કરવી..
 - ફક્ત સિમટમ્સ નહિ ધરાવતા કર્મચારીઓ/ માલિકો ને પરવાનગી આપવામાં આવશે.
 - તમમા કર્મચારીઓ/ માલિકોઓ હોટલ ની અંદર ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.
 - પોસ્ટર્સ/ સ્ટેન્ડીઝ /ઓડિયો-વિઝીયલ માધ્યમ થી COVID-19 ની સલામતી અંગે ના ઉપયો દર્શવાના રહેશે

- સોશ્યલ – ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરવાનું રહેશે.
- મોટી ઉમરના કર્મચારી, ગર્ભવતી મહિલાઓ તેમજ મેડીકલ કંડીશનમાં હોય તેવા કર્મચારીને પબ્લિક સીધા સંપર્કમાં આવવા દેવા શક્ય હોય વર્ક ફ્રોમ હોમ કલ્ચર આપનાવું.
- કર્મચારીઓ ને નિયમિત ગરમ પીણાં જેવાકે, ચા, કોફી તેમજ ઉકાળાનું સેવન કરાવવું અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન C, B કોમ્પ્લેક્સ તેમજ ઝીંકની ગોળીઓ નું ડૉક્ટરની સલાહ મુજબ સેવન કરાવવું.
- કર્મચારીઓ ને હોમીયોપેથીક દવા આર્સેનિક આલ્બમ અને આયુર્વેદિક દવા સંશમની વટીનું સેવન કરવા સલાહ આપવી
- પબ્લિક પાર્કિંગ પ્લેસ અને વધુ વ્યક્તિઓ ભેગા થતા હોય ત્યાં સોશ્યલ – ડિસ્ટનસિંગ નું ફરિજયાત પાલન કરવું.
- જો વેલે પાર્કિંગ ની સુવિધા ઉપલબ્ધ હોય તેવા કિસ્સામાં ઓપરેટીંગ સ્ટાફે ફરિજયાત માસ્ક પહેરવું.
- ગાડીઓના ડોર હેન્ડલ ચાવીઓને ડીસ ઈનફેક્ટ કરવું.
- લાઈનમાં ઉભી રહેતી વખતે બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછુ ૬ ફૂટ નું અંતર રાખવાનું રહેશે.
- સ્ટાફ અને ગૂડસ સપ્લાય માટે અલગ-અલગ એન્ટ્રી-એક્ઝીટની વ્યવસ્થા કરવી.
- માલસામાનની હેરફેર વખતે કાળજી રાખવી અને વારંવાર ડીસઈનફેક્ટ કરવું.
- રેસ્ટોરેન્ટમાં સીટીંગ કેપેસિટીના ૫૦% જ બેસાડી શકાશે અને જેમાં સોશ્યલ- ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરવાનું રહેશે.
- ડિસ્પોઝેબલ મેનુ નો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
- કાપડના નેપકીન ને બદલે ડીઝપોઝેબલ નેપકીન વાપરવા વધુ હિતાવહ છે.
- બુફે સર્વિસમાં સોશ્યલ – ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરવાનું રહેશે.
- લીફ્ટમાં માણસની સખ્યા માર્યાદિત કરવી.
- એસ્કેલેટર પર એક વ્યક્તિ છોડી ને ઉભા રહેવું.
- એરકંડીશનનું ટેમ્પરેચર ૨૪ થી ૩૦ સેલ્શીયસ રાખવું.
- મોટા મેળાવડા / વધુ લોકોને ભેગા થવું પ્રતિબંધિત છે.
- રેસ્ટોરેન્ટના બાથરૂમ, વોશિંગ સ્ટેશન અને પાણી પીવાની જગ્યા ને વારંવાર સેનેટાઈઝ કરવી.
- ફેસ કવર માસ્ક અને ગોલ્ઝની ચકાસણી માલિકને કરવાની રહેશે.
- બાથરૂમની સફાઈ સમયાંતરે કરવી.
- ડીઝીટલ માધ્યમ થી ચુકવણી કરવાનો આગ્રહ રાખવો.
- દરેક કસ્ટમર પછી ટેબલને સેનેટાઈઝ કરવું.

- રસોડામાં પણ સોશ્યલ – ડિસ્ટનસિંગ ધ્યાન રહે અને ફેસ માસ્ક અવશ્ય પહેરવા.
- ગેમિંગ આર્કેડ તેમજ બાળકોને રમવાની જગ્યા બંધ રહેશે.

5 જો કોઈ સંક્રમણ કે કન્ફોર્મ કેસ આવે તો.....

1. એ વ્યક્તિને અન્ય એક રૂમ માં આઈસોલેટ કરવી.
2. ડોક્ટર તપાસ કરે ત્યાં સુધી ફેસ પર ફીરજીયાત માસ્ક પહેરી રાખવું.
3. નજીકના ક્લીનિક કે હોસ્પિટલમાં તરતજ જાણ કરવી કે ડીસ્ટ્રીક હેલ્થ લાઈન ને જણાવવું.
4. પબ્લિક હેલ્થ ઓથોરીટીએ જરૂરી કાર્યવાહી કરવી અને કોન્ટેક્ટ ટ્રેસિંગ ની કામગીરી કરવી.
5. જો પોઝિટીવ કેસ મળે તો તરત જ પ્રીમાસીસ ને ડીસઇન્ફેક્ટ કરવું.

* * *